

તારીખ: _____ ડિપોઝિટ રકમ: _____

પેતુ _____

હું પૂર્વિ કર્ક છું કે સોહડ ડિપોઝિટ નોકરીની બોહર, ઘોટની જીનવા પુરહકારો ભેટ વારસાની ચુકવણી માટે નથી.

થાપણકારની સહી: _____

થાપણકારતરુનું નામ: _____

સેપક નંબર _____

ઓઉન્ટ ધારક સાથે સંબંધ: _____

વિવિધ સૂચનાઓ

- કૃપા કરીને મહિનામાં એકવાર તમારી પાસબુક અપડેટ કરાવો.
- કૃપા કરીને તમારી ઓફાઇન વિગતો ઇન્ટરનેટ બેંકિંગ જાહેર કરશો નહીં. યુઝર આઈડી અને પાસવર્ડ એટીએમ ડેબિટ કાર્ડ કેડિટ કાર્ડ મોબાઇલ બેંકિંગ વ્યક્તિગત માહિતી કોઈપણ વ્યક્તિને આપવી નહીં.
- તમામ ચાર્જ અને શરતો સમર્પાતરે બદલાઈ શકે છે. વધુ માહિતી માટે કૃપા કરીને બેંકની વેબસાઇટ www.janabank.com ની મુલાકાત લો.
- રૂ. 50,000 થી વધુ રોકડ ડિપોઝિટ માટે કૃપા કરીને તમારો PAN નંબર જણાવો અથવા ફોર્મ 60 ની સહી કરેલી નકલ રજૂ કરો.
- ગ્રાહક ખાતરી કરવા માટે બંધાયેલા છે કે ડિપોઝિટ સ્વિચ પરની વિગતો સચોટ છે અને એક ઇન્સ્ટ્રુમેન્ટ રોકડની વિગતો સાથે મેળ ખાય છે.
- ખોટા વચનોનો શિકાર ન બનો, શકારપદ યોજનાઓથી સાવધ રહો.

शरतो

આ પે-ઇન-સ્લિપ ફક્ત ડિપોઝિટનું મેમોરેન્ડમ છે.

ડિપોઝિટ શહેરની અન્ય બેંકો પર ખેંચાયેલી વસ્તુઓ, દરેક શહેર માટે લાગુ ક્લિયરિંગ હાઉસના નિર્દેશો અનુસાર ક્લિયરિંગ માટે મોકલવામાં આવશે.

રકમ જમા કરેલા શહેરની બહાર ચૂકવવાપાત્ર વસ્તુઓ કલેક્શન માટે મોકલવામાં આવશે. વસ્તુઓ વસૂલાત પર જમા કરવામાં આવશે.

ડિપોઝિટ માટે વસ્તુઓ પ્રાપ્ત કરતી વખતે, બેંક ફક્ત ડિપોઝિટરના કલેક્શન એજન્ટ તરીકે કાર્ય કરે છે અને આવી વસ્તુઓની વસૂલાત માટે કોઈ જવાબદારી લેતી નથી.

ડિપોઝિટ માટેની બધી વસ્તુઓ બેંક દ્વારા સ્વીકારવામાં આવે છે કારણ કે ડિપોઝિટર તેના પર દેખાતી તમામ સહીઓ અને એન્ડોર્સમેન્ટની જેન્ચ્યુઈનનેસ, માન્યતા અને સચ્ચાઈ માટે સંપૂર્ણ જવાબદારી લે છે.